

જનસંપર્ક અધીકારી દ્વારા  
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર  
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩  
કંટ્રોલરૂમ ટેલીફોન નંબર ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૨/૦૩/૨૦૧૭ રવિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૫૧૩/૧૭

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૧૦૮ કેસ કરી, ૯૩ વ્યક્તિઓને ઝડપી, ૩૯૦ લીટર દેશી દારૂ, ૪૦ બોટલ ઈંગ્લીશ દારૂ, ૫૫ ક્વાર્ટર ઈંગ્લીશ દારૂ, ૧૩ બીયર ટીન, ૦૨ મોટર સાયકલ અને ૦૧ રિક્ષા કબજે કરી હતી. તેમજ જુગારધારા હેઠળ ૦૬ કેસ કરી ૨૦ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૩૧,૩૫૫/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૫૧૪/૧૭

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૨૨૧ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી.૯૩ મુજબ ૦૭ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૧ વ્યક્તિની અટકાયત કરી હતી.

બળજબરીથી કાર લઇ ગયા :-

સમાચાર યાદી નં.૫૧૫/૧૭

ઘાટલોડીયા : અર્ચનભાઈ કલ્પેશભાઈ શાહ (ઉ.વ.૩૦)(રહે,સહજાનંદ ઓએસીસ પેટ્રોલપંપ પાસે મેમનગર ગામ ઘાટલોડીયા) એ ઘાટલોડીયા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૧/૦૩/૧૭ ના કલાક ૨/૦૦ વાગ્યાના સુમારે ઘાટલોડીયા માનવ મંદિર પાસે, આર થ્રી મોલના પાર્કિંગમાંથી આરોપી પંકીતભાઈ પટેલ (જેના પુરા નામ સરનામાની ખબર નથી) એ તેની હોન્ડા અમેઝ ગાડીને થયેલ નુકસાન બાબતે અર્ચનભાઈ પાસેથી રૂપિયા ૧,૦૦,૦૦૦/- ની માંગણી કર્યા બાદ, અર્ચનભાઈનાં ઝુમકાર ઇન્ડીયા પ્રા.લી. કંપનીમાં કામ કરતા કીરીટભાઈ પાસેથી, અર્ચનભાઈની કંપનીની ગાડીઓની ચાવીઓ તથા અર્ચનભાઈની કંપનીની ઓડી ક્યુ-૩ નંબર એમ.એચ.-૧૪-એફ.સી.-૪૮૯૭ કારની ચાવી બળજબરીથી લઇ ગાડી લઇ નાસી ગયો છે. આ ગુનાની તપાસ હે.કો.શ્રી મહેશસિંહ દશરથસિંહ ચલાવે છે.

સોનાનો દોરો ખેંચી તોડી લઇ ગયા :-

સમાચાર યાદી નં.૫૧૬/૧૭

જી.આઇ.ડી.સી.વટવા : જયંતીલાલ મફતલાલ પટેલ (ઉ.વ.૫૦)(રહે.વનદેવી બંગ્લોઝ સ્મૃતી મંદિરની બાજુમાં ઘોડાસર) તા.૧૧/૩/૧૭ રાતના ૯/૦૦ વાગ્યાના સુમારે ત્રિકમપુરા પાટિયા પાસે આવેલ રૂબ્રાક્ષ કોમ્પલેક્ષ પાસે આવેલ કાંટા સામે રોડ ઉપરથી એક્ટીવા ચલાવી પસાર થઇ રહ્યા હતા ત્યારે એક પલ્સર મોટર સાયકલ પર આવેલ બે પુરૂષ જયંતીલાલને “તમે કેમ મારા ઉપર થુક્યા છો” તેમ જણાવી બોલાચાલી કરી, એક ઇસમે જયંતીલાલના ગળામાંથી સોનાની ચેઈન કિંમત રૂપિયા ૩૦,૦૦૦/- ખેંચી તોડી લીધેલ તેમજ મોટર સાયકલ પાછળ બેઠેલ ઇસમે જયંતીલાલનાં હાથમાંથી સોનાની વીંટી કિંમત રૂપિયા ૫,૦૦૦/- અને ખિસ્સામાંથી રોકડા રૂપિયા ૧૦,૦૦૦/- કાઢી લઈ નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ જયંતીલાલ પટેલે જી.આઇ.ડી.સી.વટવા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પોસઇ.શ્રી વી.એન.વાઘેલા ચલાવે છે.

વેજલપુર : પ્રતિભાબહેન વા/ઓ અમરતલાલ સંઘવી (રહે,રવિ કિરણ સોસાયટી, વેજલપુર રોડ વેજલપુર) તા.૧૧/૩/૧૭ સાંજના ૬/૪૫ વાગ્યાના સુમારે વેજલપુર જલદર્શન સોસાયટી પાસે રોડ ઉપરથી ચાલતા પસાર થઇ રહ્યા હતા ત્યારે એક્ટીવા ચાલક પુરૂષ પ્રતિભાબહેનના ગળામાંથી સોનાની ચેઇન કિંમત રૂપિયા ૪૦,૦૦૦/- ખેંચી તોડી લઇ નાસી ગયો હતો. આ અંગેની ફરીયાદ પ્રતિભાબહેન સંઘવીએ વેજલપુર પોલીસસ્ટેશન ખાતે નોંધાવી છે.આ ગુનાની તપાસ પોસ.શ્રી એ.બી.જાડેજા ચલાવે છે.

ગાડીનો કાચ તોડી ચોરી :-

સમાચાર યાદી નં.૫૧૭/૧૭

ગુજરાત યુનિવર્સિટી : શીતલબેન વા/ઓ કમલેશભાઈ શાહ (રહે, સિવંતા એપાર્ટમેન્ટ ગાંધી આશ્રમની સામે આશ્રમ રોડ) એ તા.૧૦/૩/૧૭ રાતના ૯/૦૦ થી ૧૦/૧૫ વાગ્યા દરમ્યાન નવરંગપુરા વિજય ચાર રસ્તા, સુચિતા એપાર્ટમેન્ટ બસ સ્ટેશનની બાજુમાં પોતાની કાર પાર્ક કરેલ હતી. જે કારની ડાબી સાઇડનો કાચ તોડી, અજાણી વ્યક્તિ કારમાંથી લિનોવા કંપનીનું લેપટોપ કિંમત રૂપિયા ૪૫,૦૦૦/- તથા પાસપોર્ટ મુકેલ બેગની ચોરી કરી લઇ ગઇ છે. આ અંગેની ફરીયાદ શીતલબહેન શાહે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી જે.આર.ભાયકન ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૫૧૮/૧૭

પાલડી : સેવંતિભાઈ મફતભાઈ શાહ (ઉ.વ.૭૨)(રહે,સુષ્ટી ટાવર નવા શારદા મંદીર રોડ પાલડી) એ કોઇ અગમ્ય કારણસર તા.૧૧/૩/૧૭ બપોરના ૧/૦૦ વાગ્યા પહેલાં કોઇપણ સમયે પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે પાલડી પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી મહેન્દ્રસિંહ અદેસિંહ ચલાવે છે.

નિકોલ : ધવલ સ/ઓ રશીકભાઈ પંચાલ (ઉ.વ.૨૨)(રહે,આશીર્વાદ સ્ટેટશ ફ્લેટ, બાપાશ્રી પ્રાઇડની પાસે મનમોહન ચાર રસ્તા, નિકોલ) એ કોઇ અગમ્ય કારણસર તા.૧૧/૩/૧૭ સાંજના ૬/૩૦ વાગ્યાનાં સુમારે પોતાના ઘરે છતના હુકમાં કપડુ બાંધી, ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે નિકોલ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી દિપસિંગ ઉદાજી ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.